

B.Ed. Semester - 4 (CBCS) Examination
March/April - 2026 (New Course)
G-1 Accounting(Ssc - 5)

Time: 1:15 Hours

Marks:35

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન-૧ નીચેના પ્રત્યેક પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. (૦૫)
- 1) સ્થિર મૂડી પ્રથામાં ભાગીદારનો નફો કયા ખાતે જમા કરવામાં આવે છે?
 - 2) પાઘડીનું પુનઃમૂલ્યાંકન એટલે શું?
 - 3) જપ્ત થયેલા શેર ફરી કઈ શરતોએ બહાર પાડી શકાય?
 - 4) નાણાંકીય વિશ્લેષણ એટલે શું?
 - 5) કયા વ્યવહારો હંમેશા કામગીરીની પ્રવૃત્તિઓ હોય છે?
- પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ પાંચ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. (૦૬ માંથી ૦૫) (૧૦)
- 1) અશોક, જિતેન્દ્ર અને કલ્પેશ એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ ૩ : ૨ : ૧ છે. જિતેન્દ્રને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના ૧૦% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો Rs. 1,65,000 હોય તો જિતેન્દ્રને કુલ કેટલી રકમ મળશે ?
 - 2) ભાગીદારી પેઢીમાં પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત કેવા સંજોગોમાં ઉદભવે છે ?
 - 3) જામીનગીરી પ્રિમીયમ એટલે શું ?
 - 4) તરલતાનો કોઈ એક ગુણોત્તર સમજાવો.
 - 5) નીચેની કંપનીઓની કામગીરી પ્રવૃત્તિ જણાવો :
 (i) વેપાર કરતી કંપનીઓ (ii) વીમા કંપનીઓ
 - 6) નાણાંકીય વિશ્લેષણના પ્રકારો જણાવો.
- પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ પાંચ પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. (૦૬ માંથી ૦૫) (૨૦)
- 1) ભાગીદારીની વ્યાખ્યા આપી, ભાગીદારીના લક્ષણો જણાવો.
 - 2) પાઘડીના મૂલ્યાંકનને અસર કરતાં પરિબલો સમજાવો.
 - 3) પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેરનો તફાવત દર્શાવો.
 - 4) તુલનાત્મક નાણાંકીય પત્રકોનું મહત્વ સમજાવો.
 - 5) ગુણોત્તર વિશ્લેષણના ચાર હેતુઓ સમજાવો.
 - 6) કામગીરી પ્રવૃત્તિઓ એટલે શું? કામગીરીની પ્રવૃત્તિઓમાંથી ઉદભવતા રોકડ પ્રવાહ વિશે વિગતે સમજાવો.

ENGLISH VERSION

Que.1 Answer the following questions. (05)

- 1) Profit of a partner is credited to which account under fixed capital account method?
- 2) What is revaluation of goodwill?
- 3) In which circumstances do companies Reissue of forfeited shares?
- 4) What is Financial Analysis?
- 5) Which transactions are always operating activities?

Que.2 Answer any five of the following questions in short. (05 Out of 06) (10)

- 1) Ashok , jitendra and Kalpesh are partners of a firm. Their capital proportion is 3 : 2 : 1. Jitendra is entitled to receive commission 10% of net profit after deduction of his such share. What amount will be received by Jitendra, when profit of the firm is Rs.1,65,000 at the end of the year.
- 2) Under what circumstances does the need for valuation of goodwill arise in a partnership firm?
- 3) What is securities premium ?
- 4) Explain any one ratio of liquidity.
- 5) Describe the operating activities for the following companies:
(i) Trading Companies (ii) Insurance Companies
- 6) Explain the different types of financial analysis.

Que.3 Answer any five of the following questions in brief. (05 Out of 06) (20)

- 1) Give definition of partnership and explain the characteristic of partnership.
- 2) Explain the factors affecting the valuation of a goodwill.
- 3) Show the difference between Preference shares and equity shares.
- 4) Explain the importance of comparative financial statements.
- 5) Explain four objectives of ratio analysis.
- 6) What is operating activities? Explain in detail about cash flows arising from operating activities.
